

0× 0/0 83 240

13/4/2022

هِ وَوَدُوْ يَ مَوْرُوْهُ مَ مُرَدُّهُ مَ مُرَدُّهُ مَ مُرَوَّهُ مَ مُرَوَّهُ مَ مُرَوَّهُ مَ مُرَوَّهُ مَ مُر April 13, 2022 استور من من المنظم ا

010 011 43 41	بر وُ بُرسُوب
מל מ	מ' 0 / 2 מקינת די זק
ר מוני אם למוני שי מפת ער ער ער אר	
برو گره سور و مرور و 10 مع مرد مروع در و مرد کرد و مروم مرد مرد در د	
0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0	1.1
رِدِرُوَّ مَرْ مَرْمُوْهُ مِرْ:IUL)321-A/321/2022/78	
תָרָעָלֶייִי בּאירָ: 13 הינָיאָפָ 2022 תַרָּעָלִייאי בּאירָי: 13 הינָיאָפָ	
ים דיי רים דיים דיים פיים ביים ביים ביים ביים ביים ביים ב	
وَ وَسُ رَمَرُ ذُورُ مُرَ مِنْ مُعْ مِنْ مُرْسُرُ مُرْسُرُسٍ 2022 مُبْوِمِوْ 13 رِسْرُ 2022 مُبْوِمِوْ 19 وَ	
رُسْرُدُيْمُ وْرُورْدُ 12:30 لِدُ رُورُمُرُوْ. هُونِسْ رُمُرْدُوْرُ بَرُجِ فِيْمِ لَيْمِسْ رِدْوُسُّدُنْ	
טייני לי לי וו איי בייני אבן הפא על פר בארכ על הפרקל ב הבא ארים בייני בי	
زَرَرَءُدُوَرِئُو شُوْهُ وِ رِقُرِيَّهُ مَنْ مُوْهُ وِ رِقُرِيْ info@thulhaadhoo.gov.mv رَرَرَءُدُو وَاللهِ	
مرد سرو درو مرد مرد روز در درو و شرب مرود مردود مردود مروموس	8.1
ري رُيُّدُي مِرْدُرُمُ وَ وَوَ وَرِعْرَبُرُى مُرْدُونُ وَمِنْ رَسِّسُرُمُو. وَوَ وَرِعْرَبُرَى	0.1
كَارْشُ عَارِينَ كُورِ كَاشْشُورٍ بَرْصُورٍ كَاشْرُونَ تُشْرُدُ وَوَكُرُونَ كُسْوَشْ 09:30 مَّرُ وَشُورُورُورُ	
12:30 ئرۇ.	
מם : 0	
رِدُرِوْ دُنْ مُرْسُ: info@thulhaadhoo.gov.mv	
ئى شەر: 6600006 ئىرىنى: 6600000	
ם 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0	
ננט 00, ניט 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0	9.1
ברני מיני מיני ברני מיני מיני מיני מיני מיני מיני מיני מ	
שַּלַבٌ צִצְבָּהֶת תְבָּג בֹרְנִבֶּבֶּה בְּנִבְיֹה בְּנִבְיֹה בְּנִבּיה בְּנִבּיה בַּנִבְיה בַ בַּנִב בַּנִב בַּנְב	
رُوْرِوْ 20 وَ صَعَرَ مُرْوَرَى 12:30 رَّهِ مُرْوَدُهُ info@thulhaadhoo.gov.mv مَرْ رِوْرِوْ	9.2
מו מ	
) 0) כ) כט ×0 × כש)) הכתת בתפתמת ביתפתמפי	
רב רינים אם יכי רינים ביי היים של היים או היים או אינים אינים או אינים אינים או אינים אינים אינים אינים אינים א הב רינית ליית ביים או היים אינים	12.1
הצוח תייניתם.	13.1
ورُس صُورُدُورُ رُدُورُ رُدُعُ رِدُرُو مُسَرِّدُ الْمُعَادِدُ الْمُعَادُ الْمُعَادِدُ الْمُعَادُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعِمِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادِدُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعَادُ الْمُعِمِي الْمُعَادِدُ الْمُعَادُ الْمُعِمِي الْمُعَادُ ال	18.1

چۇڭدۇ دەرۇق ئىرۇپ، چۇشىچە، چۇڭدۇ ئۇرۇندە، دۇر دەھىسەۋىر April 13, 2022

24.1
28.1
30.1

مَنْ سُوسُ 2 - صُوسُ (سُرَارُ وَمُرْهُوكُونُ مِنْ وَوَ مِيْ سُونُ

- 2.1.1 ورُوْرِ مُرَدُى وُ مُرْوَرُهُ عُنَّ وَكُنْرُو وَرُدُو مُرَدُو مُرَاثِهِ مُنْ مِنْ مُرْدُو مُرَدُد.
 - 2.1.2 بُرُجْ سِرَمر سَوِيْ كَالْرُسْرَى مَرْمِسْ مَرْجِ سَوْجَ يِرِ كَامَرُ حِوَرِدُو كَا بُرْجُ سِرَمْ مِرْمَدُد.
- 2.1.3 مَا يَمْ عِوْ مَ مَرَعِ دُ الْأَرْدُ وَرُرُ مَرَعِ مُوْعِي مَا مُووِوَرِوً مَا يَمْ عِوْدُ وَوَ
- 2.1.4 مُوِرْدُ وَمُوْرِدُهُ وِرَوِّهِهُ وَكُوْرِهُ وَرُدُو مُورِدُ مُرَدِّ مُنْ صُحْمِ لَمُووَوَرِدُ مُورِدُو
- 2.2 جو دُرُور کَرُور کَرُور کَرُور کُرُور کَرُور کُرور کارور کارو

- 3.3.1 .3.3 بَرُدُوْ وَجُ عَ مَرْ وَسُرِي مِنْ وَ مُرْتِي مِنْ وَ مُرْتِي مِنْ وَمُرْتِي مِنْ مَرْسُرُوْ وَمُرَوْ وَمُرَوْ وَوَرُوْ مَاسُ الْمَرْمُوْ وَرُوْ وَرُوْ مَاسُ الْمُرْمُوْ وَرُوْ وَرُوْ مَاسُ الْمُرْمُونُ وَرُوْ وَرُوْ مَاسُ الْمُرْمُونُ وَرُوْ وَرُوْ مَاسُ الْمُرْمُونُ وَرُوْ وَرُوْ مُرَامُونُ وَرُوْ وَرُو وَرُوْ مَاسُونُ وَمُرْمُونُ وَرُوْ وَرُوْ وَرُوْ مَاسُونُ وَمُرْمُونُ وَرُوْ وَالْمِوْ وَرُوْ وَالْمُوا وَالْمُوالِمُوا وَالْمُوا وَا

هِ وَكَ دُوْ وَ وَهُوْ هُمْ مَا مُرَدِّهُ مَا مُرَدِّهُ مَا مُرَاهُ مَا مُوْ هُمُ مَا مُرَاهُ مَا مُوْ هُمُ مُ April 13, 2022

3.3.2 ئۇھىرىم ئىمۇرۇرى كەرىم ئۇھىرى ئۇھىرى ئىرىدى ئۇھىرى ھۇردى ھۇردى دۇرۇرى ھۇردى دۇرۇرى ھۇردى دۇرۇرۇرى ھۇردى دۇرۇرۇرى ھەردى ئۇھىرى ھۇردى دۇرۇرۇرى ھەردى ھە

3.3.2 كَا يَرْمُ وَ وَ مَا مُومِ وَكُورُ كُورُ مِرْمُ وَ الْرَارُ وَ الْمُورُ مُرَارِ وَ الْمُورُ مِنْ وَ وَرُورُ وَ اللهِ مَا الْمُورُ وَ الْمُورُ وَ الْمُورُ وَالْمُورُ وَالْمُولُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُولُولُولُولُ وَالْمُولِ وَالْمُولِ وَالْمُولِ وَالْمُولُولُولُ

3.3.5 سَمُرَّا يُر لَسُرُوسِ مَلَّادٍ، بُرُهُولُ وِرَجْ يُ لَسُرُوسِ مِنْسُ هُوَدُى وِرُسُمُلَادُهِ. سَدِرْ تَدِرِيْ، بِي سُرُولُولُولِ مَسُرَدُ وَيُرْمُ مَالُونُ فِي مَالُولُولِ مِنْ مَالُولُولِ مِنْ مَالُولُو

- 5. ﴿ وَمِنْ مُدُمَّرُ مُدَرِّدُ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدُ مُرَدِّ مُرَدُولِ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدِّ مُرَدُّ مُرْدُولُ مُرَدُّ مُرْدُولُ مُرَدُّ مُرَدُ مُرَدُ مُرَدُّ مُرَدُّ مُ مُرَدُ مُ مُرَدُّ مُ مُرَدُ مُ مُرَدُّ مُ مُرَدُّ مُ مُرَدُ مُ مُرَدُ مُ مُرَدُّ مُ مُرَدُ مُ مُرَدُ مُ مُ مُرَدُّ مُ مُ مُرَدُمُ مُ مُ مُرَدُ مُ مُ مُرَدُ
- ٥٠ مُرْسِرْسُو
 ١٥٠ هُوْسُ (بَرْرُوْ وَيُرْمُونُ وَيُرْمُونُ وَيُرْمُونُ وَيُوْلُو مُرْسُونُ وَيُورُدُو وَيُرْمُونُ وَيُرْمُ وَيُرْمُ وَيُرْمُونُ وَيُرْمُ وَيْمُ وَيْمُ وَيْمُ وَيْمُ وَيُرْمُونُ وَيُرْمُ وَيُرْمُ وَيُرْمُ وَيُرْمُ وَيْمُ وَيْمُونُ وَيُونُونُ وَيْمُونُ وَيْمُونُ وَيُعْمُونُ وَيْمُونُ وَيْمُونُ و فَيْمُونُ وَيْمُونُ وَيُعْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيُعْمُونُ وَيُعْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيْمُونُ و فَيْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيُعْمُونُ وَيْمُونُ ولِمُونُ وَيُعْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيْمُونُ وَيُعْمُونُ وَيُعْمُونُ وَيُعْمُونُ وَيُعُونُونُ وَيْمُونُ وَيُعُونُونُ وَيُعُمُونُ وَيْمُونُ وَيْمُ وَلِمُ وَالْمُونُ وَلِ

מל בל בל בל המשפת

7. هُوَرُدُ وَهُوَ مِنْ اللهِ مِنْ وَهُو وَدُوْ وَرُسْرُهُوْ وَرَسْرُهُوْ وَرَسْرُهُ وَرَسْرُهُوْ مِنْ مِنْ وَم رِدْسُورُهُوْ مُورُدُ وَيُوْ وَرُسُونُ مُورُدُوْ وَمُرْسُونُونُ وَمُورُوْنُ مُنْ وَرَسْرُونُوْنُونُ وَمُرْسُون

7.1.1 صور سوع (من من سوس - 1)

7.1.3 دُرُهُ اللَّهُ وَ وَ دُرُر رُدُ اللَّهِ وَدُور اللَّهُ وَدُورُ مُرْدُ اللَّهُ اللَّهُ مُرْدُ (اللَّهُ اللَّهُ مُرْدُ اللَّهُ مُرْدُ اللَّهُ اللَّهُ مُرْدُ اللَّهُ اللّلِي اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللّلْمُ اللَّهُ اللَّالِي اللَّا اللَّهُ اللَّهُ اللَّهُ اللَّا اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللّ

7.1.4 ئى ئۇۋۇرۇر (ئىرى ئىرى سۇس 4-4)

هِ وَكُذُوْ وَ دَرُوْدُوْ هَ مَا مُرَدُّرُهُ مَا مُرَادُهُ مَا مُرَادُهُ مَا مُرَادُهُ مَا مُرَادُهُ مَا مُرَا April 13, 2022

7.1.5 مُرَحُ مُرَجُ اللَّهِ الللَّهِ اللَّهِ ا

7.1.6 مُرُهُ شَوْرُ (سَرُ سَمِيرُ -6)

7.1.7

- 8. ﴿ وَوَ وَ وَ مِنْ رَمَرُدُو وَ مُرَ مَرِدُو وَ مُرَدُو وَ مُرْ مَرْدُو وَ مَرْدُو وَ مَرْدُو وَ وَ مَرْدُو وَ مَرْدُو وَ مَرْدُو وَ وَ مَرْدُو وَ مَرْدُو وَ وَ وَ مَرْدُو وَ وَ مَرْدُو وَ وَ مَرْدُو وَ وَ وَمِرْدُو وَ وَ وَمِرْدُو وَ وَ وَمِرْدُو وَ وَمِنْ مِنْ وَمِنْ وَمُونِ وَمِنْ وَمِنْ وَمُرْدُونُ وَمِنْ وَالْمُعُلِقِي مِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ فَالْمُعُلِمُ وَمِنْ فَالْمِنْ وَمِنْ وَمِنْ فَالْمِنْ وَمِنْ فَالْمِنْ وَمِنْ وَمِنْ فَالْمِنْ وَمِنْ فَالْمِنْ وَمِنْ فَالْمِي مِنْ فَالْمِنْ وَالْمِنْ وَالْمِنْ وَالْمِنْ وَالْمِنْ وَالْمِنْ فَالْمُوا مِنْ مِنْ فَالْمُوا مِنْ مِنْ مِنْ فَالْمِنْ وَالْمِ

رَوْ رَوْدُ وَرَوْدُ وَرَاسَوْمِ مِوْدُوْدُ لِمُرْسَوْدُ وَرَوْدُ وَالْمُوالِقُودُ وَالْمُوالِقُودُ وَالْمُودُ وَالْمُوالِقُودُ وَالْمُولِقُودُ وَالْمُولِقُودُ وَالْمُوالِقُودُ وَالْمُوالِقُودُ وَالْمُوالِقُودُ وَالْمُولِقُودُ وَالْمُولُولُولُولُ

- اً 9.1 دِرْسُرُورُ دُمْ عُنْ لَا يَوْرُورُ وَ عُنْ الْمُورُورُ وَ مُورُدُورُ وَ مُورُدُورُ وَ مُورُدُورُ وَ مُ دُمْ مُنْ اللهِ الله
- 9.2 ﴿ وَوَدُورُورُورُ مِنْ وَدُورُورُ مُورُ اللهِ اللهِ عَلَى اللهِ اله

- هِ وَكَ دُوْ وَ وَهُوْ هُمْ مَا مُرَدِّهُ مَا مُرَدِّهُ مَا مُرَاهُ مَا مُرَاهُ مَا مُرَاهُ مَا مُوْ هُمُ مُا م April 13, 2022
- 10.2 . 10.1 كَرِوَّ دُوْرُ مُرَّ دُوْرُ وَكُوْرُ مُورُ وَكُوْدُ كُورُونُ دُورُ وَدُو دُورُ وَكُورُ وكُورُ وَكُورُ وَك

(שת) סיציות האחת ממת "שת מחת ממת ממת

- ۱۱. هو و و و در مرز و و مرد مرز و مرد مرد مرد مرد مرد مرد و مرد مرد و مرد مرد و مرد مرد مرد و م

- 14.6 دُرُورُورُ وَ اللَّهُ مَا مُورُورُ وَ الْمُورُورُ وَ الْمُورُورُ وَ الْمُورُورُ وَ الْمُورُورُ وَ اللَّهُ اللْ

- 16.0 هِ وَدُرُدُنَ مَ مِ وَسُرُ رَبُرَءُ رِبُرَ مِي وَرِدِوَ وَدُوْدُوَّهُ رَبِرِ وِرَدُوْدُ رَبِرِ وِرَرُسُوهُ وَيُ سُرُهُ مَ وَمِ وَرُدُودُ وَيَ وَرُدُودُ وَيَ مِرْدُودُ وَيُ سُرُهُ وَيُ سُرُهُ وَوَ مُرْدُونُ وَيُرْدُونُ وَيُعْرِدُونُ وَيُونُونُونُ وَيُعْرِدُونُ وَيَعْرِدُونُ وَيُعْرِدُونُ وَيُعْرِدُونُ وَيُعْرِدُونُ وَيُعْرِدُونُ وَيُعْرِدُونُ وَيُعْرِدُونُ وَيَعْرِدُونُ وَيُعْرِدُونُ وَيَعْرِدُونُ وَيُعْرِدُونُ وَيُعْرِدُونُ وَيَعْرِدُونُ وَيْعِيْرُونُ وَيَعْرِدُونُ وَيَعْرِدُونُ وَيَعْرِدُونُ وَيْرُونُ وَيُونُونُ وَيَعْرِدُونُ وَيَعْرُدُونُ وَيْعِيْرُونُ وَيْعِيْرُونُ وَيْكُونُ وَيْعِيْرُونُ وَيْعُونُ وَيْعِيْرُونُ وَيْعِيْرُونُ وَيْعِيْرُونُ وَيْعُونُ وَيْعِيْرُونُ وَالْمُعُونُ وَالْعِيْرُونُ وَالْمُونُ وَالْمُعِلِي وَالْعُونُ وَالْمُعُونُ وَالْمُعُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُ وَا
 - بِرْسُمُورُ (عَ مُورُو عَلَى 16.1.1 وَبِرَدُ مَرْدُورُ فِي وَسِرُ رُبَرَرًا وَوْ (عَ مُورُو 2)
- - 16.1.3 مَعْ سَوَمْرَ / مِهِ الْمُرْرَوَمُونَ رُسَرَ وَمُرَوَ مُورِدُ مِهِ مَوْرَدُ سَوْعٌ وَرُرُ فَسَرَوَ وَمُرَوَ وَمُرَدَ وَمُرَدَو وَمُرَدَ وَمُرَدَو وَمُرَدَ وَمُرَدَو وَمُرَدَ وَمُرَدَو وَمُرَدَو وَمُرَدَو وَمُرَدَو وَمُرَدَ وَمُرَدَو وَمُرَدَو وَمُرَدُونَ وَمُرْدُونَ وَمُرُدُونَ وَمُرْدُونَ وَمُرْدُونَ وَمُرْدُونَ وَمُرْدُونَ وَمُرْدُونَ وَمُرْدُونَ وَمُرْدُونَ وَمُرْدُونَ وَمُونَا وَمُونَا وَمُونَا وَمُرْدُونَ وَمُرْدُونَا وَمُرْدُونَ وَمُونَا لَا مُعْرَدُونَ وَمُونَا لَا مُعْرَدُونَا لَا مُعْرَدُونَا لَا مُعْرِدُونَا لَا مُعْرَدُونَا لَا مُعْرِدُونَا لَا مُعْرِدُ لَالْمُ لَالْمُونَا لَا لَالْمُونَا لَالْمُونَا لَالْمُونَا لَالْمُ لَالْمُ لِلْمُ لِلْمُ لَالْمُ لِلْمُ لِلْمُ لَالْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُونِ لِلْمُ لِلْمُونِ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِ
 - 16.1.4 تُومِرُ وَمَعْرُورُو صِوْمَرُ رُمَرُكً وَمُدْوَدُ وَمِّرُورِ فَ فَرَوْدُ (فَيَ فُرُونُو (عَ فُرُونُو ا
- - 16.1.6 رُجْ رِ مُعِيضَا مُنْ سُمْ وَمُعْ وَمُعْ عَالَمَ مُنْ اللَّهِ مِنْ عَالَمَ مُنْ مُنْ اللَّهِ

- ﴿ وَكَذَهُ وَهُوْهُمْ مُرَدُّوُهُمْ مَا مُرَمُّرُهُمْ مَا مُرَمُّرُ مُوهُمُ مُوهُمُ مُرَّا مُرَمُّ مُوْمُ مُوس April 13, 2022
- 16.1.7 وَوْغِ وَهُ مِسْوَسُ عَرْضِهُ مَرْهُ مِرْهُ مِرْهُ مُرْمِعِ اللهِ الْمُرْمُ عَلَيْهُ عَلَيْهُ مَرِدُوهُ وَمِرْهُ مُرْمُوعُ اللهِ اللهُ ا
- - 16.1.8 وَيُ سُمِرُمِ مِ رُمُرُوَسُونَ وَمُؤَرِّ وَمُؤَرِّ مُوَرَدُ مِنْ وَمُؤْمِنُونَ مُرْرَدُ وَمُ
- 16.2.1 ﴿ وَمَرْدُو وَ مُرْدُو وَ مُرْدُو وَ مَرْدُو وَ وَمَرْدُو وَ وَمَرْدُو وَ وَمِرْدُو وَمُو وَمُو وَمُو وَالْمُودُ وَ وَمِرْدُو وَالْمُودُ وَالْمُؤْمِدُ وَالْمُؤْمِدُ وَالْمُؤْمِدُ وَمُؤْمِدُ وَالْمُؤْمِدُ وَالْمُؤْمِدُ وَالْمُؤْمِدُ وَالْمُؤْمِدُونُ وَالْمُؤْمِدُ وَالْمُودُ وَالْمُؤْمِدُ وَالْمُؤْمِ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُؤْمِدُومُ وَالْمُومُ وَالْمُؤْمِدُومُ وا
- 16.2.2 ﴿ وَمُرْرَدُ وَمُرْرَدُ وَمُوْ وَمُو وَمُو وَمُو فَا وَمُورُو لَا وَمِرَوَ لَا مُوَرَدُو لَا وَمُورُو لَا وَمُورُو لَا وَمُورُو لَا وَمُورُو لَا وَمُرَدُو لَا وَمُرْدُو . وَمُورُو لَا وَمُورُو لَا وَمُرْدُو . وَمُورُو لَا وَمُورُو لَا وَمُرْدُو .
- (٦) کرو کرکو کرکو کرکو کو کرکو کوکو کرکو کوکو کرکو کرکو
- (س) ئۇرۇپو دَرْدُ ھىرى ھۇس دۇرى دېرى دىرى ھىرى برۇئىس سەچ دە ترۇكى ھىرى مەھ دىرى دىرى دىرى ھىرىدۇ.
- مَرِيدُ وَ مَرْمَرُ مَرَدُو مَرْدُو مِنْدُورُ مِنْ مَرْدُو مِنْدُورُ مِنْدُورُ مِنْ مُرْدُو مِنْدُورُ مِنْ مُرْدُو مِنْدُورُ مِنْ مُرْدُورُ مِنْدُورُ مِنْ مُرْدُورُ مِنُونُ مِنْ مُرْدُورُ مِنْ مُرْدُورُ مِنْ مُنْ مُنْ مُنْ مُرْدُورُ مِنْ مُ مُنْ مُ مُو
- (س) رَسْرَوْ مَرْبُوْ مُوْرِدُوْ مِنْ مُرْبُوْ مِنْ مُرْبُورُ وَرِقِي مُوْرِدُوْ وَرِوْدُورُورُورُورُورُورُورُو سِعِ دُمْرُوْدُرُ وَمُرْفُورُورُورُورُ
- (x) چ ئۇئىش ۋىرۋىر ئۆئىش قىلىم ئىلى «ئىلى «ئىلى «ئىلى «ئىلى دۇئى «ئىلى »ئىلى «ئىلى «ئىلى «ئىلى «ئىلى «ئىلى «ئىلى «ئىلى «ئىلى »ئىلى «ئىلى «ئىلى «ئىلى »ئىلى «ئىلى
- (0) مُرِدُو وَمُرْسِ وَرَسْ وَرُسْ وَرُسْ وَمُو لَا مَرَا مُنْ مُنْ مُنْ اللَّهِ مُرْسِدُهِ اللَّهِ اللَّهُ اللَّاللَّالِي اللَّالِي اللَّهُ اللَّا اللَّهُ اللَّا اللَّهُ اللَّهُ اللَّا اللَّا اللّل

هِ وَكَ دُوْ وَ وَهُوْ هُمْ مَا مُرَدِّهُ مَا مُرَدِّهُ مَا مُرَاهُ مَا مُرَاهُ مَا مُرَاهُ مَا مُوْ هُمُ مُا م April 13, 2022

16.3.1 كَوَّدِ وَهُ وَ وَ وَهُ وَهُ مَرْ مَا مُرَّ وَدُورَ وَ وَهُ وَ وَ وَهُ وَ وَ وَهُ وَ وَهُ مَا وَ وَهُ وَ وَ وَهُ وَ وَ وَهُ وَ وَ وَهُ مَا وَ وَ وَهُ وَ وَهُ وَ وَهُ وَ وَهُ وَ وَ وَهُ وَ وَ وَهُ وَالْمُوا وَ وَالْمُوا وَ وَالْمُوا وَالْمُولُ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُؤْمُ وَالْمُؤْمُ وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُوا وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُؤْمِ وَالْمُومُ وَالْمُؤْمِ وَالْمُوا مُوا مُوا مُوالْمُوا مُوالْمُوا مُوالْم

(بر) ھوس (بركروس

- 17. ﴿ وَكُورُ هُمُورُ كُنْ مُرْسُرُ مُورُ مُورُدُ لَنَهُ وَ وَكُرُو كُنُو مُرَدُ كُنُو مُورُدُ مُورُدُ مُورُدُ لَنْهُ عَنْ عَنْ عَنْ عَنْ مُورِ مُرْدُو. لَنْهُ مِنْ عَنْ عَنْ عَنْ مُورِدُو.
 - 17.2 مع دُمُردُ عُمْرُدُر صِوْرُدُ سَسْ وِدُور دُسْسَرُم وَسُرُدُ وَسُرَدُو.
- 17.3 سوچ دُهُرِی مَرَّهُ وَهُرِیْ دُمْ مَرْدُر چِوَرُ دُرُرُو وَ وَرُرُو وَ وَرُرُو وَ وَرُدُو وَالْمُوالِقُوا وَالْمُوا وَا
- 17.4 رُرُرُو ۾ ڪُرهُ ۾ رُهُرَسُونِ ۾ ڪُروُ رُو ڪُرو ڪَرو ڪَرو ڪَرو ڪَرو جَرو دَرو جَرو دَهُرو دَرو دَرو دَرو د ري برب مارو وَرو دَ
- 18. هُوَرُدُ وَ مُورِدُ وَ مُرْدَا وَ وَ مَا مُرْدَا وَ مُرْدَا وَ هُوَ مُرْدُ وَ مُرْدُو وَمُرْدُو وَ مُرْدُو وَ مُرْدُودُ وَ مُرْدُودُ وَمُودُ وَمُودُودُ وَالْمُودُ وَمُودُودُ وَمُودُودُ وَمُودُودُ وَمُودُ وَمُودُ وَمُودُودُ وَمُودُ وَمُودُ وَمُودُودُ وَالْمُودُ وَالْمُ وَالْمُودُ والْمُودُ وَالْمُودُ وَالْمُودُ
- مَرْکَ بِهِ مَرْکَ بِهُ مُرْکَ بُرُونِ مُرْکَ بُرُونِ مُرِکِ بُرِدُ مُرِکِ مُرْکَ کُرُدُ کُرُدُ کُرُدُ کُرُدُ ک مُرْکُ بُرُسُ بُرُونُ مُرْکِرُ مُرْکِ بُرُدُ مُرْکِرُ مِرْکُ مِرْکُ مِرْکُ مِرْکُ بِی مُرْکُ بِی مُرْکُ بِی ک مُرْکُ دُورُکُ دُرُورُ مُرْکِ بُرُسُ بُرُ مُرْکِرُ مُرْکِ بُرُدُ مِرْکُ مِرْکُ مِرْکُ مِرْکُ مِرْکُ مِرْکُ الْکُونِ مِرْکُ مُرْکُ مِرْکُ مِرْکُو مِرْکُ مِرْکُ مِرْکُ مِرْکُو مِرْکُ مِرْکُونُ مُرْکُونُ مِرْکُونُ مِرِکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرِکُونُ مِرْکُونُ مِرِکُونُ مِرْکُونُ مِرِکُونُ مِرْکُونُ مِرِکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرِکُونُ مِرِکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرِکُونُ مِرِکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرْکُونُ مِرِکُونُ مِرِکُونُ مِرِکُونُ مِرِکُونُ مِرْکُونُ مِرْکُونُ مِونُ مِونُونُ مِرْکُونُ مِونُ مِونُ مِونُ مِرْکُونُ مِرْکُونُ مِرْکُونُ مِونُ مِرْکُونُ مِونُ مِونُ مِونُ مِونُ مِرْکُونُ مِونُ مِونُونُ مِونُ مِونُونُ مِونُ مِونُ
 - 18.3 مِرْمِ مُرْمِ وَمُو مِنْ وَمْرَةً مِنْ مُرْمَةً مِرْمُدُ مُؤْمِدُ مُؤْمِدُ مُرَدُهُ مُرَدُهُ مُر

(۵) مورس روور مورم سرس

- 20. هُوَ رُرُو وَ رُ رَدُو وَ رُرُرُو وَ رُرُرُو وَ رُرُرُو وَ رُوُ وَ رُرُو وَ رُرُو وَ رُرُو وَ رُو وَ رُرُو وَ رُو وَ رُو وَ رُرُو وَ رُو وَرُو وَ رُو وَ رَا مِ وَالْمُ وَا
 - 20.2. ﴿ وَمُو رُوْمُ مُرْسُرِ ﴿ وَوَسُ مَوْعَدُمُ مُرْسُرُورُو مُنْ مُرْدُدُهُ .
- 20.3 هِ وَسُرْدُوْوْرُ رُوْعَ رُسُوْرِ هُ هُرِدُ اللهِ مُرْوَبُ سَوَعُوْرِ دُرُوْرُ مُرْدُ عُرْدُ عُرْدُ وَسُر دُوْرُدُوْوْرُ رُدُعَ رُسُورِ سَرَدُ عِوْسُ رُدُوْسُ رِسُرْسِ، غَرِدُ رُسُرْسَ بَسُودِ مُرْسُرُ بَسُودِ وَوَسُ دُوْرُدُو وَنُرُ سَمِعُ وَرُوَ دَرُوْ سَمِعُ وَرُوْ دَرُوْ سَمِعُ وَرُوْ دَرُوْسُ دَرُوْرُ دَرُوسُ مِنَا وَرُو

```
﴿ وَهُوْ وَهُ وَهُوْ هُمُ مُرَدُّ مُ مُرَدُّ مُ مُرَدُّ مُ مُرَدُّ مُرَدُّ مُرَدُّ مُرَدُّ مُرَدُّ مُرَدُّ مُر
April 13, 2022
```

21. رَبِرَرُو وَ مِهِ مُرْدُو وَ مِهِ مُرْدُو وَ مِهِ مُرْدُونُ وَمِهُ مُرِدُو وَ مُرْسَوُرُهُ وَمُرْدُو وَوَ م مَهُودُورُ وَ وَ مُرْدُونُ وَمِرْ رَاجُرُدُ وَمِيْ رَاجُرُدُ وَمِيْ رَاجُدُ وَمُرْدُونَ وَمِيْدُ وَمِيْ رَاجُ

تَرْهُدُ 21.2 هِ وَوْ وَرَبُّ وَرِبُّ وَ وَمُوْرِ عِوْرٍ هُرْسُ وِلَا وَرِبُّ وَرِبُّ وَرَبُّ وَمُوْرِهُ وَرَبُّ وَمُوْرِهُ وَرَبُّ وَمُوْرِهُ وَرَبُّ وَمُوْرِهُ وَرَبُّ وَمُوْرِهُ وَرَبُّ وَرَبُّ وَمُوْرِهُ وَرَبُّ وَرَبُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُؤْدُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَال

22.1.1 مُورِّدُ مُورِّدُهُ وْبِرَرُوُ وَالْمُورُورُونَ

ه وَسُرَهُونَ وَ عَنْ مَا مُونَ وَ مُرَاءُ وَمُنْ مُنْ اللَّهِ وَمُسْرَهُ الْمُرْدُونُ وَمُرَاءً وَمُرَّهُ وَمُرْدُونُ وَمُرَاءً مَا مُنْ وَسِرْ وَسِرْ وَسِرْ وَسِرْ وَسِرْدُونُ وَمُرَاءً وَمُرْدُونُ وَمُرَاءً وَمُرَّادُونُ وَمُرْدُونُ وَمُ

مَ مَسِ يَهُوْدُ وَ عَلَى مَ وَدُودُ وَهِ اللَّهِ مُومُومُ مَا مُومُورُ وَمَرَدُ وَعَ وَ عَلَامُ مَا مَا مَا وَدُورُ وَ مَا مَا وَاللَّهُ عَلَامُ وَاللَّهُ عَلَامُ وَاللَّهُ عَلَامُ وَاللَّهُ وَاللَّهُ عَلَامُ وَاللَّهُ وَاللّلَّالِمُ وَاللَّهُ وَاللَّالِ

23. ﴿ وَمُورُهُ وَ وَمُ اللَّهُ مَا وَهُورُهُ وَمُرَاءُ وَمُرَاءُ وَمُرْدُورُ وَمُورُهُ وَمُرَاءُ وَمُرَاءً وَمُراءً وَمُرَاءً وَمُراءً وَمُرَاءً وَمُراءً ومُراءً ومُر

> 26. ه وَسُرُ 26.1 ه وَسُرُ مَّ وَرَهُ هُو وَيَمَّ هَرُهُ مَ مَرَّ هُمُ وَيَرَّهُ هُو وَيَمَّ هُمَا مُرَّ وِيَرَوْشُ وَسُرَدُو. مَّ وَيُرَّهُ مَا مُرَّ فِي مُرَاثِينَ مُرَاثِينَ مُرَاثِينَ مِنْ فَيْسُرُونَ وَيَمَّ فَيَمَامُ وَيُرَوْشُ وَسُ

> > 1918×3

0 2 0 6 0 7 6

(27.6) (

27.2 . 27.1 مُرَّسُرُ وَرِوَّ خَمْدُورُو مُرَّدُورُ مِرْ رُوْرُورُورُ مُرَّفُ مُرْدُورُ مَا مُرَّدُورُ مُرَّدُورُ مُرَّدُورُ مُرَّدُورُ مُرَّدُورُ مُرَّدُورُ مُرَّدُورُ مُرَّدُورُ مُرَّدُورُ مُرْدُورُ مُرُورُورُ مُرْدُورُ مُرُدُورُ مُرُدُورُ مُرُورُ مُرْدُورُ مُرْدُورُ مُرْدُورُ مُرُورُ مُرْدُو

هِ وَكَ دُنَّ وَدُوْرَةُ مُ مَا يُرَدِّهُ مِ مِنْ مِهِ مَا هُمَ مَا مُوْرِهُ مَا مُرَّالُهُ مَا مُوْرِدُ مَا مُ April 13, 2022

(צ) לעל לעל של שיע האבש פל א

- 28.2. و يَ سَهِ مَهِ هُوَ دُورُ رَهُ رَءَ رَءَ مَهُ هُو سَهُ مَهُ مُورُ دُورُ دُورُ هُورُ هُورُ دُورُ وَهُورُ وَهُورُورُ وَهُورُ وَهُورُ وَهُورُ وَهُورُورُ وَهُورُ وَهُورُ وَهُورُ وَالْمُورُورُ وَالْمُورُ
- 28.4 ﴿ وَوَ وَرَوْدَ وَرَوْدَ وَرَوْدَ وَ وَرَدُو وَ وَرَدُو وَ وَرَدُو وَ وَرَوْدُو وَرَوْدُو وَ وَرَوْدُو وَ وَرَدُو وَ وَرَدُو وَ وَرَدُو وَ وَرَدُو وَ وَرَدُو وَ وَرَدُو وَرَدُ وَرَدُو وَرَدُو وَرَدُو وَالْرَدُو وَالْرَدُو وَالْرَالِ وَالْمُ
 - 28.5 عِنْ سُرِيعِ وَ وَمُورَمُ مِ عِنْ رُسَرَةً مُعِيدُسْ وَسِوْسُ 30 فَرَوْرُوْ.
 - 29. مُنْ وَسُونُ 29.1 وَصُورُدُر دُونُ مُنْ وَسُورُ وَرَا مُنْ وَرَا اللهِ مَنْ وَرَا مُنْ وَمُونَا وَرَا اللهِ مُنْ وَاللهِ وَاللهِ مُنْ وَاللهِ مُنْ وَاللهِ مُنْ وَاللهُ وَاللهِ مُنْ وَاللهِ وَاللهِ وَاللهِ مُنْ وَاللّهُ وَلَّهُ وَاللّهُ وَاللّهُ

الرسط المراز ال

- 29.2 بُرِي وَرُوْرَ وَ وَرُوْرَوَ وَرُوْرَ وَ وَرَارَوْرَ وَرَارَوْرَ وَرَارَوْرَ وَرَارَوْرَ وَرَارَوْرَ وَرَ بُرِي وَرَارِ وَرَارِدُورَ وَرَارِدُورُ وَرَادُورُ وَالْمُورُ وَرَادُورُ وَرَادُورُ وَالْمُورُ وَالْمُورُ وَرَادُورُ وَالْمُورُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُورُ وَالْمُورُ وَالْمُورُورُ وَالْمُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ وَالْمُورُورُ
- 29.3 بُرِيرُوَسُ دَيْرَوَ يَ دُوْدَر رَرَرَوَسُ سَدَلَدَ دَوْرَنَدُ وَسُرَنَهُ مِرْوَمُ مِنْ مَرْوَمُ وَرَوْ يَ وَرَدُو يَرَوْ وَرَوْ يَرَرَوْسُ مِنْ وَرَدُو يَرَوْسُ مِنْ وَرَدُو يَرَرُو مِنْ مِنْ وَرَدُو يَرَدُو وَرَدُو يَرَدُو وَرَدُو يَرَدُو مِنْ مِنْ مِنْ وَرَدُو يَرَدُو وَرَدُو يَرَدُو وَرَدُو يَرَدُو مِنْ مِنْ مِنْ وَرَدُو وَرَدُو يَرَدُو وَرَدُو يَرَدُو وَرَدُو وَرَدُو يَرَدُو وَرَدُو وَرَدُو

﴿ وَهُوْ وَهُ وَهُوْ هُمُ مُرَدُّ مُ مُرَدُّ مُ مُرَدُّ مُ مُرَدُّ مُرَدُّ مُرَدُّ مُرَدُّ مُرَدُّ مُرَدُّ مُر April 13, 2022

- ٥٥٠ ١٥٠ ١٥٠ ١٥٠ ١٥٠٠ ١٥٠٠ ١٥٠ ١٥٠٠ ١٥٠٠ ١٥٠٠ ١٥٠٠ ١٥٠٠ ١٥٠٠ ١٥٠٠ -
- 30.3 مَرْدُوْهُوْ دُوْدِرَهُوْ دُوْدِرَوْوُ 17.09 كَدِ صَرَّرَادُوْلُو، وَرُدِيْ وَوَرُدُو رَوْرُورُ وَرَرُورُ وَرَرُورُ مَرْدُولُو، وَرَدَاوُ مَرْدُورُ مَرْدُورُ مَرْدُورُ مَرْدُورُ مَرْدُولُو، وَرَدَاوُ مَرْدُورُ وَرَدُورُ وَلَا مَرِورُ وَرَدُورُ وَرَدُورُ وَلَا عَرَدُورُ وَرَدُورُ وَا وَرَدُورُ وَرُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُور
- 31. قَرْمَوْ وَوْرِدُو وَرْمَوْ وَوْرِدَوْ وَوْرِدَوْ وَوْرِدُو وَرْمَوْ وَوْرِدُو وَرْمَوْ وَوْرُدُو وَرْمَوْ وَوْرُدُو وَرْمَوْ وَوْرُدُو وَرْمَوْ وَرَمْ وَرْمُوْ وَرَمْ وَرْمُو وَرَمْ وَرَمْ وَرَمْ وَرَمْ وَرَمْ وَرَمْ وَرَمْ وَرَمْ وَالْمُوا وَمُو وَمُو مِلْمُوا وَمُو وَمُوامِ وَمُو وَمُو وَمُو وَم

هُوَوْ دُوْ وَرُوْوَهُ مَا يُرَوِّهُ مَا مُوْهُ هُوْ وَوَ وَا عَالَا مُوْهُ مَا مُوْهُ مُوْهُ مَا مُوْهُ مُوْهُ April 13, 2022

- 32. وَسَرَنْ يُوسُ 32.1 " وَسَوَرَاهُو وَ مَرِيَ يُرَمُّوا الْوَرْ فَسَرَوْرِ دُوَسٍ، وَيُوْسُونَ فِي وَكُوْرُ الْوَرْسَوْدِ دُوْسُونِ دُوْرُمُورُو.
- 32.3 الرَّسُونِ الْمُرْدُونِ الْمُرْدُونِ الْمُرْدُونِ الْمُرْدُونِ الْمُرْدُونِ الْمُرْدُورُ اللَّهُ اللّلِي اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللّلْمُ اللَّهُ اللَّالِي اللَّالِي اللَّهُ اللَّالِي اللَّهُ اللَّهُ اللَّالِي اللَّهُ اللّ
- 32.4 "وَسَهُمُوهُ دُوْهُ وَسَهُمُوهُ وَسَهُمُوهُ وَمُرَوَدُهُ وَسَهُمُوهُ وَرَدُوهِ مُرْهُ وَهُمُ وَسَهُمُوهُ وَسَهُمُوهُ وَسَهُمُوهُ وَسَهُمُوهُ وَسَهُمُوهُ وَمُرْهُ وَرَدُنَا وَرَسَّارُمُوهُ.
- 32.5 "رُرُهُ الْمُوْرُ" الْوَرْ فَالْمَوْرِ رُوْسِ، وَالْمَوْرِدُورُ وَالْمِرْدِ، وَالْمُولَادُورُ وَالْمُولِدُورُ . رَادُورُو وَلِيْرِي اللهِ اللهُ اللهِ اللهُ اللهِ الل
- 33. و رَرُرُورُ وَرُرُ وَرُرُورُ وَرُرُ وَرُرُورُ وَرُرُ وَرُرُورُ وَرُرُورُ وَرُرُورُ وَرُرُورُ وَرُرُورُ وَرُرُورُ وَرُرُورُ وَرُرُورُ وَرُرُورُ وَرُورُ وَرُرُورُ وَرُورُورُ وَرُورُ ورَالْ وَرُورُ ورَالْ وَرَالِ وَالْرُورُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُ وَا

- 34. ﻣِﻴُﺮُﻭْﺵ . 34.1 رِدْرُوْسُ وَوْدُ وَرُرُوْسُ يَرُوْ دَارُسُوْ وَالْمِدُونُ دَارُوْسُ وَالْهُ دَارُرُوْسُ وَالْمُرَارُ دَارُوْسُ وَالْمُرُوسُ وَالْمُرْسُوسُ وَالْمُوسُ وَالْمُرْسُوسُ وَالْمُوسُ وَالْمُرْسُوسُ وَالْمُوسُ والْمُوسُ وَالْمُوسُ ولِي وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُسُوسُ وَالْمُوسُ ولِهُ مِلْمُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوسُ وَالْمُوس
- رَوَّوْلَا يُرْسُ 6 مُرَّمُ وَمِيْ مُرَسُ وَيَّمُونُ وَمِيْ مُرَسُ وَيُمْوَلُو وَمِيْ وَمُرْمُ مُوْفُ عَامِدُ وَمِيْ وَمِرْوَا وَيُوْفِي وَمِرْوَدُو مِنْ وَمِرْوَدُو مِنْ وَمِرْوَدُو مِنْ وَمِرْوَدُو مِنْ وَمِرْوَدُو مِنْ وَمِرْوُ وَمُرْمُ عِنْ وَمِرْوَدُو مِنْ وَمِرْوَدُو مِنْ وَمِرْدُو مِنْ وَمِنْ وَمِرْدُو مِنْ وَمِرْدُو مِنْ وَمِرْدُو مِنْ وَمِرْدُو مِنْ وَمِنْ وَنْ مِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ وَمِنْ
- 35. مَوْمُ مُوْمُ مُرْمُوْمُ وَمُوْمُ وَمُوْمُ وَمُومُ مُومُ مُرْمُومُ مُرْمُومُ مُرْمُومُ مُرْمُومُ وَسُومُ م مِوْرُومُومُ مِرْمُومُ وَمِرْمُومُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَسُومُومُ وَمُرْمُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُ وَمُونُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُ وَمُونُ وَمُونُ وَمُونُ وَمُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُ وَمُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُونُ وَمُونُ وَمُونُونُ وَمُ مُونُونُ ومُونُونُ ومُونُ ومُونُونُ ومُونُونُ ومُونُونُ ومُونُ مُونُونُ ومُونُونُ ومُونُونُ ومُونُ مُونُونُ ومُونُ مُونُ ومُونُ مُونُ ومُونُ مُونُونُ مُونُ ومُونُ مُ مُونُ ومُ مُونُ ومُونُ مُ مُونُونُ مُ مُونُونُ مُونُ مُونُ مُونُ مُونُ مُ مُونُونُ مُ مُونُ مُ مُونُ مُ مُونُ مُ مُونُ مُونُ مُونُ مُونُ مُ مُونُ مُ مُونُ

- چَوُرُدُوْ کَوْرُوْکُوْ مَانْدُوْتُ مَانْدُوْتُ مَانْدُوْتُ مَانْدُوْتُ مَانُوْدُوْ مَانُوْدُوْ مَانُوْدُوْ مَ April 13, 2022

- 37. غَرِوْسُرْنَرُوْرِ 37.1. دُرُهُ سُوْدُوْرِدُ وُرُورُوُ وُرُورُورُ وُسُرُنَا مُرْسُرُونُ وَرُورُورُو وَرُورُورُو دُورِ وَسُرْنَا مُورُورُ وَسُرُ وَرُورُدُ دُرُورُ دُرُورُ وَمُورُدُ وَمُورُورُ وَمُرَدُونَ وَمُورِدُونَ وَمُور دورون
- $\hat{\xi}^{0} \hat{\xi}^{0} \hat{\xi}^{0}$ $\hat{\xi}^{0} \hat{\xi}^{0} \hat$

 - LD (﴿ عُرُمُ مُوسُمُ اللَّهُ عَلَيْهُ اللَّهُ عَلَيْهُ اللَّهُ اللَّهُ عَلَيْهُ اللَّهُ اللّلْمُ اللَّهُ اللَّالَّ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ اللَّهُ ال
- 37.3 وَسَهُرُمُو مُرْسِو وَسَوَّ وَهُوَمُومُ وَسَهُرَاهُ بُرُولُو وَ وَمُوَمُ وَرِسَّ وَرَسَّ وَرَسَّ وَرَسَّ وَسَوْدَ وَسَوْدٍ وَرَسَّوْدُ وَسَوْدٍ وَسُودٍ وَسَوْدٍ وَمُودُولًا وَسَوْدٍ وَسُودٍ وَسَوْدٍ وَسُودٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسُودٍ وَسَوْدٍ وَسَادٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَادٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ وَسَوْدٍ
- 37.4 وَسَرَمَوْهُ فَوْوَ رُدُوْ مُكُوْ مِرْسَارُهُ رَبُوْهُ وِلَمِ يَعَ الْأَوْمُ فَا وَلَوْمُ مَرُوْهُ مِرْدُ دُرُهُ سُوْلُ فَالْمُولِمُ رُبُولُ مِنْ مُولِمُ يُسْرِدُو.
- 38.1 گورگری کرورگری کرورگری کرورگری کرورگری کرورگری کرورگری گری کرورگری کرورگ
- رُدُوْتُ مُرَوْتُ مُوْتُرِيْ دُرُهُ مُوْتُوْرُ هُمِوْتُرُو مِرْدُ هُمُوْتُرُو مُرَدُ هُمُوْرُدُ هُمُورُدُ هُمُورُدُ هُمُورُدُ هُمُورُدُ مُرَدُدُ مُرَدُ مُرَدُ مُرَدُ مُرَدُ مُرَدُ مُرَدُ مُرَدُدُ وَمُرْدُونُ مُؤْدُدُ مُرُدُدُ وَمُرْدُ مُرَدُدُ وَمُرْدُ مُرَدُدُ وَمُرْدُونُ مُؤْدُدُ مُرَدُدُ وَمُرْدُدُ وَمُرْدُونُ وَمُرْدُدُ وَمُونُونُ ورُدُودُ وَمُرْدُودُ وَمُونُودُ وَمُرْدُودُ وَمُرْدُدُ وَمُرْدُدُ وَمُرْدُودُ وَمُرْدُدُ وَمُرْدُدُ وَمُرْدُدُ وَمُرْدُودُ وَمُرْدُدُ وَمُرْدُدُ وَمُرْدُدُ وَمُرْدُدُ وَمُرْدُودُ وَمُرْدُودُ وَالْدُودُ وَمُرْدُودُ وَمُرْدُودُ وَالْمُودُ ولِكُونُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ ولِكُونُ والْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ وَالْمُودُ والْمُودُ ولِهُ لَالْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِلْمُ لِل

هِ وَرَقَدُوْ مَا مُرَدِّرُ مُنْ مَا مُرَدِّرُ مَا مُرَدِّرُ مَا مُرَدِّرُ مَا مُرَدِّرُ مَا مُرَدِّرُ مَا مُر April 13, 2022

- 39. مُرْسِرُسُو 39. دِرُدُهُ الْوَدُورِ وَرُدُهُ اللّهِ وَمَا اللّهُ اللّهِ وَمَا اللّهُ اللّهِ وَمَا اللّهُ اللّهِ وَمَا اللّهُ الللّهُ اللّهُ اللّهُ اللّهُ
- 40. غَرْبُ دُورِ اللهِ وَوَ اللهُ وَوَ اللهُ اللهِ وَرَادُهُ مُرَّالُهُ مُنْ عَرْبُ اللهُ عَرْبُ اللهِ اللهُ اللهُولِ اللهُ ا
- 42. دره م و و و دره م و دره م و دره و دره

	2000 ב 2000 מממש ת תחשים מ	#
ג עאפיינתפי.		ه توکسر
	هوسر (مرزع ورد (غرور 2)	1
	لاروسرائره سركر مرفي المركز و مرفير كردو و كروس و مرفير كالمروس المروس المروس و مرفير كالمروس المروس المروس المروس والمرفي المروس المرو	2
	رُرْرُو دُرُ دُورِ عُلَى مُورِدُ اللهِ مُعْرِدُ اللهِ مُعْرِدُ اللهِ عُمْرِدُ اللهِ عُمْرِدُ اللهِ اللهِ اللهِ	3
	رَمْرَرُدُّ وَمُرْهُوْ وَهُرُورِ فِي فَرْهُورِ (خَ فَرْهُورِ 3)	4
	چرسو مرفي سوم مرسور مورسور (چ.ده. چرد مرفور مرفور و مرد مرفور و مرد)	5
	۱ ۵۰۵ د ۵۵ ۵۰ ۵۰ ۵۰ ۵۰ ۲ د ۱ د ۱ د ۱ د ۱ د ۱ د ۱ د ۱ د ۱ د ۱ د	6
	של כל האר ל הל ל הל ל ל אל הל ל אל אל הל הל אל הל הל אל אל הל הל אל אל אל הל הל אל א	7
	ور دو	8
	6.1 פאת ברוציאת שותים בירילים מותיב תקרים.	9
	מיני זים מיני זים בייים מינים	10
ית כשית תפ.	יין אין אין אין אין אין אין אין אין אין	ه توکیر
	שלית רת'ול באמרים בנתרת באמרים באלים באחשב הלחלה הב של פר 5	11
	הייני לארים בארים אלים אלים לארים לארים הארים אלים לארים לאר	
	﴿ وَ وَ وَ وَ وَ وَ الْكُونَ كَ مُرْسَعِ اللَّهِ مَا مُرَاعَ فَ وَسَامِعِ وَوَلَى) كَا وِالْسَرْهُ اللَّهِ فَا فَرَوَوْ 4 وَيَرِدُونَاشُ (سَرَءً وَهُ	12
מונים		ه توکیر
	נננ0 נירון און און פרט	ه کور کر
	ריינים או ביינים בי התרעות ביינים	13
	٠٠٠ ١٥٠٠ ١٥٠٠ ١٥٠٠ (١٥٥٠ ١٠٥٠ ١٥٠٠ ١٥٠٠	14
	13 V X 3 13/40/ 13 V X 13 V X 13/40/	15
	הני א בייס ב בייסיס אינים אינ	16
,	מפר או של מיל לא לא מיל לא מיל איל איל איל איל איל איל איל איל איל א	0622
	 ذُور وَ رَبْر وَ رَبْرُ وَ رَبْعُ وَالْمِ وَالْمِيْعِ وَالْمِ وَالْمِلْمِ وَالْمِلْمِ وَالْمِلْمِ وَالْمِ وَالْمِ وَالْمِ وَالْمِ وَالْمِ وَالْمِ وَالْمِلْمِ وَال	17

	243321 (241 411) 01 52742 (24) 4111 MP & & & & & & & & & & & & & & & & & &
	1 مُرْدُ
	1 ادغ برسم
	ים דירו מאום או הרפיל פינית הרפיל המונים או הרפיל המונים או המונים המונים המונים המונים המונים המונים המונים ה
	2 روی در
	2 مردِرُسُ سَرَسُوهُ يُر
	2,02 (1, (1,1) \$50,2 0,50 \(\frac{1}{2}\)
	3 رُمْرَرُءٌ رُدُي
	ي ، رُبُ و عِ
	:30 100 30 40 E:
	ש פני אינ (פאת תי תובים)
	3 وْدْمُرْمُو (صُرْمُورُوكُ مُرَدُّرُ وَسُرُمُومُ رِوْسُرُمُومُ)
	340 (34, 4,1,3 0,1 4,4,5,4,5,8,4,5,4,7,7,4,4,5,4,5,4,5,4,5,4,5,4,5,4,5
	وهي در ه الرس تامر و الرف و السادر ما ها يرو و هي و برتام و سروم
وُسُورُرُ الْرُورُ الْرُورُ الْمُرْورُ الْرُورُسِ الْمُرْورُ الْمُرْوَرُ الْمُرْوَرُ الْمُرْوَرُ الْمُرْوَرُ	﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴾ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿ ﴿
ב'''ה'רט לי	4 ء سری کر ه فروکر کر کر کر کر گرستر و کر م گرستر و کر م گر گر کر
 ٢٠٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥	
 ٢٠٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥ ٢٠٥	ا
	مُرَدُورِدُورُ وَرُرُ وَهِدُرِ وَرَرُورُورُ وَرَرُ وَرَدُورُ وَرَدُورُورُ دُورُورُ دُورُورُ دُورُورُ دُورُ وَرَدُورُورُ وَرَدُرُورُورُ وَرَدُرُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُرُورُ وَرَدُورُ وَرَدُرُورُ وَرَدُرُ وَرَدُورُ وَرَدُرُ وَرَدُورُ وَرَدُرُ وَرَدُرُورُ وَرَدُرُ وَرَدُرُورُ وَرَدُرُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُورُ وَرَدُرُ وَرَدُرُ وَرَدُرُ وَرَدُرُ وَرَدُورُ وَرَدُرُ وَرَدُورُ ورَدُورُ وَرَدُورُ وَرَا وَرَورُ وَالْكُورُ وَالْكُورُ وَالْكُورُورُ وَالْكُورُ وَالْكُو

	24332 (24.1 61.1 \$2742 EXX \$11.	<i>?</i> .1
	ייציער	-1.1
	برخ سطیر لابرو زرو اری برس	-1.2
	0 (0 (") 9 ()	-1.3
	, 00 / 00 / 00 / 00 / 00 / 00 / 00 / 00	
	٥٥٥ ١١٠ ١١٥٥ ١١٥٥ ١١٥٥ ١١٥٥ ١١٥٥ ١١٥٥ ١	-1.5
	בן . ארים. פן שיל של על של ג'י בן . ארים. פן של של של של איי	-1.6
	ם ב 20 / 2 קינוק ויתנות סיק	-1.7
	0 (0 (0 (- × 2 1) 7) 7 / 1	-1.8
מין מיולרט ירנילר "מין יסין "מין רני המרב קה של ממוצ בהתל במי אפשמת הייף ממור אפשת מיני	ר און	.2
	ארנו אר	
287	ט <i>ק</i> 'טק	#
) ט 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0		
, o l x e v x t		
, oc x & x & x & x & x & x & x & x & x & x		
	0/0/0/ / 1/0×10/ 1/20/20/20/20/20/20/20/20/20/20/20/20/20/	.3

هِ وَوَدُوْ وَدَرَوْوَ وَ مَرَدُوهُ مَ مَرَدُهُ مَ هُوَ وَ وَ وَمَرْ مَاهُ مَ وَوَدُو وَ وَمَرْ مَرْهُ مَ وَمُو April 13, 2022 عَرُورُ وَ مَ مُرَوَدُ مَا مُرْوَدُ مَا مُرْوَدُ مَا مُرْوَدُ مَا مُرْوَدُ مَا اللّهِ اللّهُ اللّهِ اللّهُ الللّهُ اللّهُ ال

24,337 UC 11.0 11.1 1 \$2.54,2 10 12VH9,P\$ 42

				2 11 22 5 2 1 .	01 (010001) (011 11). 12 SVB ENNVN SONS 5/1	هوسر ر
رور دری صوسر درور بروردرر) درور بروردررر)		0/10	(00)/(SBMNVN) - כ 0 0 י 0 י כ גע געש "מינש"מ איניש איניש איניש	#
		/ 0 ? † 2 č			2 <i>4</i> 222 (22042 422	> 0 (0
					24327 (27.047 42) \$2 7 42 SV\$\$K\$ KV}	لابرع ع
ۇرسەئ دىرۇ (درۇر ئروردىر)	0 / 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0	בר מו מו מו במו מו מ	י ב לי 0 מקפית המת'ל מ	222 צק ע	ם בכבו במינים בים בים בים בים בים בים בים בים בים ב	<i>2</i> #
	103 200	•				1

هِ وَدُوْدُوْ مَا مُرَدُّوُ مُ مَا مُرَدُّوُ مُ مَا مُرَدُّوْ مُوْدُوْ مُوْدُوْ مُوْدُوْ مُوْدُوْ مُوْدُوْ مُو April 13, 2022 عَامُونُو مُورِدُوْ مَا مُورُوْدُوْ مَا مُورُوْدُوْ مُورُوْدُوْ مُورُوْدُوْ مُورُوْدُوْ مُورُوْدُوْ مُورُوْدُو

زُرِمْو و 05 (وَرُرُ) دُرَيْرَة مُعِرْدُرِ مُعْرَوْرِهُ دُوْعِرْبِرِ دُسَوْرُمُو دُوْعِرْبِرِ دُسَوْمُومُ

ם ביו'ל נורב אינו ל בבייר (' (0 / 0) ב' ל () (0) ל ל ל ל ל ל ל ל ל ל ל ל ל ל ל ל ל ל				
ב' ה' ה' ב'	20101 20101 2010 2010 2010 2010	04, (2, 0, 1, 0, 1, 0, 1, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0,	י ים יכט יים בייים בא מים	#
	:5°28			

	, ,		
	0 6 6 3 1 7 5 9 5 M	ב עק פ ב עק '	
א מין א אינא מין א אינא א א א א א א א א א א א א א א א א	12,010	ה מנה בת פינת	אָר מיל של אין
	00 X 1, 2, 2, 3	00 X 1, 1, 1, 9	
0 / 0 0 0 / 0 / 0 / 0 / 0 0 / 0 / 0 / 0	42	65	37
כ ככים. ת היפתית.			
מין בית פ מין בין בין בין מין פית	10	20	2 / 0 7 2 / 2 / 2 2 / 2 / 2
0 . 0 ר כ כ כ כ כ כ כ כ כ כ כ כ כ כ כ כ כ כ			
6 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0	5	10	באר במילעת
אינו ל ביל מיני ביל ביל איל איל ביל ביל ביל ביל ביל ביל ביל ביל ביל ב			
ה 00 ממממ ב 1. מ 1. תמש בתפיע התפס 1. תמש בתפיע התפס			
רְהַּצָּינֵנֵגַ אֵבֶנָינִ בְּיִבָּינִ בְּפָבְּנָתְ 5 הְיִנְנֵבְינִי בְּטִבְּיִתְ הְהָּצָינִנֹגַ בְּיִבָּינִ בִּיקָבִית פּבּפּבְּתְא 5 הְיִבְבְּינִנִי בּאָבְרָ אִיבְרָהְפָּ			
وه و در			
- 101 31 606101 0 066 6310101 1 1/1/17 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2			
رِسْقَ دُرُو مُدَرُونِ مِنْ وَيُورُونُ مُرْوَرُ مُرْوَ وَسُمْرُمُونُ وَكُورُونُ وَرُسُونُ			
وَسَوْرَا مُرَارِّ وَرَرِّ وَ وَكُورُو وَ رَرَارٌ وَرَوْ وَ وَكُرُو وَ وَرَارُ وَرَوْ وَكُرُو وَمُ			
י י י י י י י י י י י י י י י י י י י			
وْجُوْرِمُرُ 5 (وَ ﴿) مُرَكِّمْ دُوْرُدُ جُهُرُمِ سَمِرْتُهُ دُوْرُدُ وَمُرْدُمُ	03	05	ر د مح تم بره
מר או או מר			
ב־ירמילת בציערת מעל בָּמָבּ משׁמֹת 10 בְּתְמֹשׁ בֹפּערתפּ. רבּק			
05 תַנִים ינוֹפָ הוֹמִנִּבְּי הְבָּאִים תְנִים (בֹיִנִי צַאַפּבּאִים) בְּשׁׁחִי			
ייט ארי			
יין אין אין אין אין אין אין אין אין אין			
מת מית במת בנה ל המת במת היינה הבמת בת בת בת הבה הבהת בת			
ייים אים אים אין			
כ ט ט ט ט ט ת בת פית נת פ .			

هِ وَوَدُوْ وَ مُرْوَدُهُ مَا مُرَدُّهُ مَا مُرَدُّهُ مَا مُرَّمُ مُرْهُ مُرْهُ مُرْهُ مُرْهُ مُرْهُ مُرْهُ مُ April 13, 2022

- مَا مُرْهُ وَ مُرْمُ وَ مُرْمُ وَ مُرْمُونِ وَ مُرْمُونُ وَ مُرْمُونُ وَ مُرْمُونُ وَمُرْمُونُ وَمُرْمُونُ وَمُونِ وَ مُرْمُونُ وَ مُرْمُونُ وَمُرْمُونُ وَمُونِ وَ مُرْمُونُ وَمُونِ وَالْمُونُ وَمُونِ وَالْمُونِ وَالْمُونِ وَالْمُونِ وَالْمُونُ ولِمُ لَالْمُونُ وَالْمُونُ وَلِمُونُ و

Form of Bid Security (Bank Guarantee)

WHEREAS,	[name of Blader] (nereinalter called the Blader) has
•	issued by the Ministry of Finance and Treasury on construction of[name of
Contract] (hereinafter called "the Bid").	- •
KNOW ALL PEOPLE by these presents that We	
	ntry] having our registered office at (hereinafter called "the Bank") are
bound unto[name of F	Purchaser] (hereinafter called "the Purchaser") in the sum of the payment well and truly to be made to the said Purchaser, the
SEALED with the Common Seal of the said Bank t	thisday of20
THE CONDITIONS of this obligation are:	
(1) If, after Bid opening, the Bidder withdra Form of Bid; or	aws his Bid during the period of Bid validity specified in the
(2) If the Bidder having been notified of the Bid validity:(a) fails or refuses to execute the Bidders, if required; or	e acceptance of his Bid by the Purchaser during the period of e Form of Agreement in accordance with the Instructions to e Performance Security, in accordance with the Instruction to
	of the Bid Price pursuant to Clause 27,
* The Bidder should insert the amount of the	Guarantee in words and figures denominated in Maldivian shown in Clause 16.1 of the Instructions to Bidders.
the Purchaser's having to substantiate his demand	pove amount upon receipt of his first written demand, without d, provided that in his demand the Purchaser will note that the e occurrence of one or any of the three conditions, specifying
for submission of bids as such deadline is stated	cluding the date
Date	THE BANK
WITNESS SEAL	
[signature, name, and address]	

هِ وَدُوْدُ عَا مُرَدُّوُ مُ مَا مُرَّدُ مُ مَا مُرَّدُ مُ مَا مُرَّدُ مُ مُرَّدُ مُ مُرَّدُ مُ مُرَّدُ مُ مُو April 13, 2022 عَا مُرْمُونُ وَ اللّٰهِ اللّٰهُ اللّٰهُ اللّٰهِ اللّٰهُ اللّ

Form of Performance Bank Guarantee (Unconditional)

To:	[name &address of Purchaser]
undert	EAS
Guara	WHEREAS it has been stipulated by you in the said Contract that the Supplier shall furnish you with a Bank ntee by a recognized bank for the sum specified therein as security for compliance with his obligations in lance with the Contract;
And w	WHEREAS we have agreed to give the Supplier such a Bank Guarantee;
up to a payabl pay yo	THEREFORE we hereby affirm that we are the Guarantor and responsible to you, on behalf of the Supplier, a total of *
	An amount is to be inserted by the Guarantor, representing the percentage of the Contract Price pecified in the Contract, in Maldivian Rufiyaa.
We he	reby waive the necessity of your demanding the said debt from the Supplier before presenting us with the id.
to be Suppli	rther agree that no change or addition to or other modification of the terms of the Contract or of the Works performed there under or of any of the Contract documents which may be made between you and the ter shall in any way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any hange, addition, or modification.
This C	Guarantee shall be valid until the date of issue of the Defects Correction Certificate.
	SIGNATURE AND SEAL OF THE GUARANTOR
	Name of Bank
	Address
	Date

هُوَدُوْدُوْ وَهُوْدُوْهُ مَا مُرَدُّرُوهُ وَهُوْدُو فَا فَرَوْدُو فَا فَرَوْدُوهُ الْمُرْ الْمُوْسُوْسُ April 13, 2022 9 - غَرُوبُو وَ عَرْوَبُو وَ عَرْدُمْ عَلَيْهِ عَلَيْهُ عَلِيهُ عَلَيْهُ عَلِي عَلَيْهُ عَلَيْهِ عَلَيْ عَلَيْهِ عَلَاهِ عَلَيْهِ عَلَيْهِ عَلَيْهِ عَلَيْهِ عَلَيْهِ عَلَيْهِ عَلَي

Form of Bank Guarantee for Advance Payment

To:	[name & address of Purchaser]
	[name of Contract]
Gentle	emen:
	cordance with the provisions of the Conditions of Contract, of the above-mentioned Contract,
under	"the Supplier") shall deposit with
[Bank as pri [name claim	or Financial Institution], as instructed by the Supplier, agree unconditionally and irrevocably to guarantee mary obligator and not as Surety merely, the payment to
be pe	rther agree that no change or addition to or other modification of the terms of the Contract or of Works to erformed there under or of any of the Contract documents which may be made between
way re	elease us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change, addition, dification.
	An amount is to be inserted by the Bank or Financial Institution representing the amount of the Advance Payment, in Maldivian Rufiyaa.
until .	Guarantee shall remain valid and in full effect from the date of the advance payment under the Contract
	truly, TURE AND SEAL:

هِ وَكَ ذَيْ وَدَرُوْقَ مَا مُرَمَّرُ مَا مَ مُورِ مَا مُورِ مُورِ مُورِ مُورِ مُورِ مُرَمَّ مُورِ مُرَمَّ مُور April 13, 2022 مَا مَا مُرَا مُرَادِ وَمُورِ وَمُورِ مُورِ مُورِ مُورِ مُورِ مُرَمَّ مُورِ مُرَمَّ مُورِ مُر

0 // 0000x עית ש איש יייףש עית ש איע איש איש יייףש	
200000 אינט אינס מינט אינס מינט אינס מינט אינס מינט אינס מינט אינס מינט אינט אינט אינט אינט אינט אינט אינט א	ېر قرنوسو
	מקיית 60 אק מקיית 60 אק
7/377/ (74/ 10/ 5/47/ Exel 2/4/ 10/	
سَرُسُو:	32.1
0 COC 12 2 Mg.	
יין אור איר איר איר איר איר איר איר איר איר אי	
سَرُسُر:	32.2
0 0 0 C 0 C 0 C 0 C 0 C 0 C 0 C 0 C 0 C	
. 2/27/2 (2/0/ / . 2/4/2 5/2/2	20.0
	32.3
. 27 (2707) . 30 38VAF-7	32.4
. 2 / 0 / 0 / 0 / 0 / 0 / 0 / 0 / 0 / 0 /	36

چَوُدُدُوْ وَرَبِرُوْمُ لَا مُرَدِّرُ مِنْ مَا مُوْمُ مَا مُورِدُ مَا مُورِدُوْ مَا مُورِدُوْ مَا مُورِدُوْ مُ April 13, 2022

ور و و ورس الرفرو	(220 (01)	- " " " " " " " " " " " " " " " " " " "	00/ 01 BMIKSAI DV /
ر در	رُدُهُ الرِدُرُهُ مِ دِيرِهِ اللهِ	52 1522 - 622)	رُقُرُوْمُرُمُو") رُّرِ
	. (() عرورمو.	5/2	פית האמצ

وُرَدُورُ وَ وَ وَرَدُونَ وَ وَرَدُونَ الْرَسَانِ وَرَدُونُ وَ وَ وَرَدُونُ الْرَسَانِ وَوَرَدُورُ وَ وَ وَرَدُونُ الْرَسَانِ وَرَدُونُ وَالْمُونُونُ وَالِهُ وَالْمُونُونُ وَالْمُونُونُونُ وَالْمُونُونُ وَالْمُونُونُ ولِي وَالْمُونُونُ وَالْمُونُونُونُ وَالْمُونُونُ وَالْمُونُونُونُ وَالْمُونُونُونُ وَالْمُونُونُ وَالْمُونُونُ وَالْمُونُونُ وَالْمُونُونُ وَالْمُونُونُونُ وَالْمُونُونُ وَالْمُونُونُونُ وَالْمُونُ وَالْمُونُ وَالْمُونُونُ وَالْمُونُونُ وَالْمُونُ وَالْمُول


سَرُمَرُ:	سَرَيْر:
: 0 % / 2 : 2 % 2	: 2° % 5
ره ر و حواد ی سرع :	: 2 / 0 / : 2 / 2 / S

April 13, 2022

1.p. 10, 2022	
رُرسر: مرد:	ئرسۇر: مرسائر: **
:مُنْ	
ינציות:	ىترىش:
: 25%	<i>حَ</i> نَّرُد:
:#2.77	:# ₂ .,,,
י יונים סיין ב דילי ב-הממפה פת צת הפית הפקפתה מתית '	0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,0,
: • • • • • • • • • • • • • • • • • • •	:,,~
سرُيرُ:	سرُسرُ:
<i>ۮ</i> ٷۜٛڎ:	ِ رَ ـُرُّـ رُـُــ:
:#2.77	:#2.,,,
2/0/ (U.2) 2/20 MM/82:	?
برور و المان	رورو دي الم

ئىرىرۇ ئۇرۇرى كەركى كەركى كەركى كەركىرى كەركىرى كەركىرى كەركىرى كەركىرى كەركىرى كەركىرى كەركىرى كەركىرى كەركىرى

1. وبرى د دُوَّ لَا بُرْدُوْ دُرُو وَ دِرْهُمَا دُرْدُوْ هُرُ دُوْ وَدُرْ وَرِدُسْ وَرُدْكُو "72 دِسْرَكُو دُسْوِسْرَدْ وَلَرُوْدُ جُسْرِشْ



- 2. 3 وَمَهُ مَرَهُ مَرْهُ مُرْهُ مُرْهُ مُرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَا مُعْمُونُ مُ مُرْهُ مُ مُرّهُ مَرْهُ مُرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مُ مُرّهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مُرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مَرْهُ مُرْهُ مُرْهُ مُرْهُ مُرْهُ مُرْهُ مُرْهُ مُرْمُ مُ مُرْهُ مُرْهُ مُرْهُ مُ مُرْهُ مُرْهُ مُرْهُ مُ مُرّهُ مُرْهُ مُ مُ مُرّهُ مُ
- 36 . وَيَرْهُو مُرَّسُ وَسِرٍ وَسَرَّوْهُو مُرَدِّهُ وَمُرَهُو مُرَدِّهُ وَمُرَّفِي وَسَرَّمُ وَمُرَدُ وَمُرَهُو مُو وَمُرَّمُ وَمُو مُرَدُو مُرَمُو مُورِدُ وَمُرَّمُ وَمُورُو مُرَّمُ وَمُورُو مُرَّمُ وَمُورُو مُرَامُ وَمُورُو مُرَامُ وَمُورُو مُرَامُ وَمُورُو مُرَامُ وَمُورُو مُرَامُ وَمُورُو مُرَامُ وَمُورُو مُرَامُو مُرَدُو وَمِي مُرْمُو مُرَدُو وَمِي مُرْمُو مُرَدُو وَمِي مُرْمُو مُرَدُو وَمِي مُرْمُو مُرَدُو وَمُورُو مُرَامُو مُرَدُو وَمُرَامُونُ مُرَدُو وَمِي مُرْمُو مُرَامُو مُرَامُونُ مُرَامُو مُرَامُولُ مُرَامُونُ مُرامُونُ مُونِ مُرامُونُ مُونِونُ مُوامِعُونُ مُونِونُونُ مُونِونُونُ مُونِونُونُ مُونِونُونُ مُونِونُ مُونُونُ مُونُونُونُ مُرامُونُ مُونُونُونُ مُرامُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُ مُونُونُ مُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُونُونُونُونُ مُونُونُونُ مُونُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُ مُونُونُ مُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُونُ مُونُونُ مُونُونُ مُونُونُ مُونُونُونُ مُونُونُ مُونُونُ مُونُونُونُ
 - 4. كَنْرْنْ بِرْجُ مُوَنْرُقْسٍ 1:2:3 كُنْ مُوكِدُرُدُ مِوْنْرُمِ، رِوَ، رِوَوْدِ مُوَرِدُونْرُسْرُوْ.

هِ رَوْدُهُ عَالَمُوْرُهُ مَا مُرَوِّدُهُ مَا مُرَوِّدُهُ مَا مُرَوِّدُهُ مَا مُرَوِّدُهُ مَا مُرَوِّدُهُ مَا مُرَوْدُهُ مُركِنَا لَعَلَى مُركِبُونُ مُركِّدُ مُرَوْدُهُ مُركِنَا لَعَلَى مُركِبُونُ مُركِبُونُ مُركِبُونُ مُركِبُونُ مُركِبُونُ مُركِبُونُ مُركِبُونُ مُركِبُونُ مُركِبُونُ مُركُونُ مُركِبُونُ مُركُونُ مُونُ مُركُونُ مُركُونُ مُركُونُ مُركُونُ مُركُونُ مُركُونُ مُونُ مُركُونُ مُونُ مُركُونُ مُونُ مُركُونُ مُونُ مُونُ مُركُونُ مُركُونُ مُركُونُ مُ مُركُونُ مُ مُركُ

- ٥٠ وَرُوْرُوْدُ وَرُورُدُ وَرُورُ وَرُورُ وَرُورُ وَرُوهُ بِرِی دُورُ وَرُورُ وَرُورُدُ وَرُورُدُ وَرُورُدُ وَرُورُورُ وَرُورُ وَالْمِنَا وَالْمِنْ وَالْمُورُ وَالْمِنْ وَالْمُورُ وَالْمُ وَالْمُورُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُورُ وَالْمُ وَالْمُ وَالْمُورُ وَالْمُ وَالْمُ وَالْمُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُ وَالْمُورُ ورُالِمُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُ وَالْمُورُا وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُورُ وَالْمُولِ وَالْمُورُ ول
- 7. ݣْرْمَّرْ وْوَرْدْ كْرْمَرْوْ دِرْدْوَمِ وْمُمَّرَدْ وْرَمْرْدْوْ.
 مَارْدِيرِ وْرْوَرْدْ كَرْمَرْمِي وَرْمُ وَرْمُورْدْوْ.
 - 8. خَرَّرِدُ مِنْ خِرِدُسِ فَيْ فَرَّمُوسَ "18" X 50 مِسْرَمُودُ مُوسِرُوْدُ مُورُوسٌ وَسُرَدُوْ.
- و. وَسَمْرَاهُ سِرِدُی وَهُ وَ هُمْ صِرْدُسِ اللهِ مَرْدُونِ مِرْسَاؤُلِمْ وِرِدِّمْدُرُ صِرْدُرُمْسُ وَسُرَوْ. رَدِرِ
 دُرُمْرُدُر دُونِ نُسِرِ رُونَا رُورُ دُرْبُ دُرْبُو دُرْدُ مُرْمَا مُرْمَا مُرْمَا مُرْمَا وَسُرَدُو.
 دُرُمُ دُرُمًا مُرْمَا وَسُرَامُ وَسُرَدُو.
 - 10 و دُسَادُمُورُ مُرْمُورُ وَسِر رُورُولُ وَمُعْرِدُهِ رُمَارٍ وَسُوَّ مُرَدُو وَسُومُرُدُونُ